



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૫/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૧૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૨ કેસ કરી, ૪૦ વ્યક્તિઓને ઝડપી, ૨૨૦ લીટર દેશી દારૂ, ૧૨૫ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૮,૯૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૧૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૧૫/૧૯

કાલુપુર : ઘનશ્યામ કિશનચંદ મુરઝાણી (ઉ.વ.૪૨)(રહે.ઉવેશી બંગલો, કે.જી.પાર્કની સામે, ઇંદિરા બ્રિજ પાસે હાંસોલ) એ તા.૧૦/૫/૧૯ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૫/૨૦૧૯ બપોરના ૦૧/૦૦ વાગ્યાના સુમારે કાલુપુર રતનપોળ શેઠનીપોળ રતન ચેમ્બર્સ દુકાન નં-૧૭ માં આવેલ “જી.આર.ડી.બ્રધર્સ” ખાતે દુકાનમાં કામ કરતા આરોપી (૧)અમિત રમેશભાઈ ઠાકોર (રહે.સરસપુર અમદાવાદ) તથા (૨)પરેશ અશોકકુમાર મારવાડી (રહે. ખેડા નડિયાદ) એ ભેગામળી અરવિંદ કાંતીલાલ ને ત્યાં આંગડિયા પેઢી થી રૂપિયા ૨,૦૬,૩૦૦/- લેવા સારૂ મોકલેલ, જે રૂપિયા મેળવી લઈ આજદીન સુધી પરત નહીં આવી, ઘનશ્યામભાઈ સાથે વિશ્વાઘાત કર્યો છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી રોહીતસિંહ લક્ષ્મણસિંહ ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૮૧૬/૧૯

બાપુનગર : ગણપતભાઈ ભોલુરામ વણઝારા (ઉ.વ.૪૨)(રહે.આકાશ ફ્લેટ ચામુંડા ડેરીની સામે હીરાવાડી બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૫/૨૦૧૯ બપોરના ૦૧/૩૦ થી સાંજના ૫/૩૦ દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમા પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા ૧,૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ગઢવી ચલાવે છે.

નિકોલ : ઉર્મીલાબહેન રાજેન્દ્રભાઈ અહેલવાર (રહે.ગેલેક્ષી બંડ્લોઝ નવા નરોડા નિકોલ) તા.૦૯/૦૫/૧૯ સાંજના ૬/૩૦ વાગ્યાના સુમારે મધુવન પાર્ટી પ્લોટ નજીક રોડ પર થી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ઉર્મીલાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મતાની ખેંચી તોડી લઈ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ ઉર્મીલાબહેન અહેલવાર એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૮૧૮/૧૯

સાબરમતી : અરવિંદકુમાર પોપટલાલ શાહ (ઉ.વ.૬૫)(રહે.પદમાવતી એપાર્ટમેન્ટ સત્યનારાયણ સોસાયટી રામબાગ રોડ શંખેશ્વર દેરાસરની પાછળ સાબરમતી) એ તા.૧૦/૫/૧૯ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૦૫/૨૦૧૯ ના કલાક ૧૦/૪૫ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના આડા કરેલ દરવાજા વાટે, કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી લાકડાની પાટ પાસે મુકેલ આશરે રૂપિયા ૮૦,૦૦૦/- અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એન.ગુર્જર ચલાવે છે.

નિકોલ : નવનીતભાઈ જમનાદાસ દેસાઈ(પટેલ)(રહે.શ્યામવિલા-૨ દેવસ્ય સ્કુલની બાજુમાં નિકોલ) એ તા.૦૯/૦૫/૧૯ રાતના ૮/૩૦ થી ૯/૦૦ વાગ્યા દરમ્યાન ડીમાઈ ની સામે આવેલ ખુલ્લા મેદાનની દિવાલની અડીને પોતાની કાર પાર્ક કરી મુકી હતી. જેની સાઇડનો કાચ તોડી કોઈ અજાણી વ્યક્તિ કારમાંથી (૧) હાર્ડ ડીસ્ક (૨) લેપટોપ બેગ (૩) લેપટોપ ચાર્જર તથા રોકડા રૂપિયા ૮૦,૦૦૦/- તથા થેલામાં મુકેલ પર્સ કે જેમા અગત્યના દસ્તાવેજો અને રોકડ રૂપિયા ૨૫૦૦૦/- મુકેલ હતા. તદુપરાંત નવનીતભાઈની પત્નીના થેલામાં મુકેલ ચાર મોબાઇલ ફોન કુલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ અંગેની ફરીયાદ નવનીતભાઈ એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એન.વાઘેલા ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૮૧૯/૧૯

રામોલ : સાગરભાઈ ઓધારભાઈ દેસાઈ(રહે,જલપરી સોસાયટી, સુમીનનગર, વસ્ત્રાલ) એ તા.૧૦/૦૫/૧૯ ના કલાક ૦૦/૦૦ થી સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘર નજીક પોતાની ફોર વ્હીલ ટવેરા ગાડી નંબર જીજી.૨૭.સી.૫૪૬૪ કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ અંગેની ફરીયાદ સાગરભાઈ દેસાઈએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.બી.વાઘેલા ચલાવે છે.

કાગડાપીઠ : મનીબહેન વા/ઓ ભુરસિંહ ભીલાલા (ઉ.વ.૨૫)(રહે.સ્કાયગ્રીન ફ્લેટ ગીરધરનગર રોડ પોસ્ટ ઓફીસ ની સામે, રાજસ્થાન હોસ્પિટલ ની બાજુમાં શાહીબાગ) તા.૦૯/૦૫/૨૦૧૯ રાતના ૮/૩૦ પહેલા કોઇપણ સમયે કાંકરીયા જુની પાયલોટ ડેરી ની સામે “ગ્રીનવેલી” ની સાઇટ ઉપર નીચે ઉતરતી વખતે આકસ્મિક રીતે પડી જતાં, સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતના ૧૦/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એ.જાડેજા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.